



JAI SHREE RAM

TEMPLE SHREE RAMJI MANDHATA

INCORPORATED 1992

CHARITÉ CANADIENNE ENREGISTRÉE / REGISTERED CANADIAN CHARITY

8155, RUE DUROCHER, MONTREAL, QUEBEC H3N 2A8

TEL.: (514) 277-9298



તા. ૧લી ઓગસ્ટ, ૨૦૧૯
મોન્ડ્રીઅલ

આદારણીય વડીલો, ભાઈઓ તથા બહેનો,
પ્રણામ,

આશા છે આપ સૌ કુષળ હશે અને સમર સીજનનો આનંદ માણી રહ્યા હશે. સર્વ પ્રથમ તાજેતરમાં જ આપણાં અમુક પરિજનોના સભ્યો સ્વર્ગે સીધાર્યા છે, એ પરિવારજનો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરીએ છીએ.

તા.૨૬મી મે, રવિવારના દિને મળેલી આપણી જાહેરસભામાં સંસ્થાની આનુસંગિક સમિતિ (contingency committee) ની વરણી કરવામાં આવી હતી જેમાં નીચે જણાવેલ સભ્યોનો સમાવેશ થાય છે.

- શ્રી નવીનભાઈ બુધાભાઈ પટેલ (ઓજલ)
- શ્રી અરવિંદભાઈ બાબુભાઈ પટેલ (ઓજલ)
- શ્રી દીપકરાય એન. પટેલ (કલમઠા)
- શ્રી રમણભાઈ બાવાભાઈ પટેલ (આટ)
- શ્રી કનુભાઈ ખંડુભાઈ પટેલ (આટ)

આ સાથે આપણાં મંદિરમાં પવિત્ર શ્રાવણમાસ દરમ્યાન યોજનારા કેટલાંક ધાર્મિક પ્રસંગોથી આપ સૌને માહિતગાર કરી રહ્યાં છીએ, આપ સૌને આ દરેક પ્રસંગોમાં પધારવા હાર્દિક આમંત્રણ છે.

- શ્રી સાઈ મહોત્સવ: શનિવાર તા.૩જી ઓગસ્ટ, સાંજે ૫:૦૦ કલાકે
પૂ. સાઈબાબાની ચરણ પાદુકાનું પૂજન, પરિક્રમા તેમજ ભજનકીર્તન સાથે શ્રી સાઈ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
મુખ્ય યજમાન - Dytech, Tricot Liesse કંપનીમાં કાર્યરત આપણાં સમાજનાં ભાઈઓ અને તેમનાં પરિવારજનો તરફથી સામૂહિક રૂપે.
- શ્રી સત્યાનારાયણ ભગવાનની કથા: શનિવાર તા.૧૦મી ઓગસ્ટ સાંજે ૫:૦૦ કલાકે
ભગવાન શ્રી સત્યાનારાયણની સામૂહિક કથામાં ભાગ લેવા માટે \$૫૧ની અનુદાન રાશી નક્કી કરવામાં આવી છે, ભાગ લેવા ઈચ્છતાં ભક્તજનોને પોતાનાં નામો મંદિરના પૂજારીશ્રીઓને નોંધાવવાની વિનંતી.
મુખ્ય યજમાન: શ્રી રાકેશ ખન્ના અને પરિવારજનો.
- ભારતીય સ્વાધીનતા દિવસ સમારોહ: ગુરુવાર તા.૧૫મી ઓગસ્ટ સવારે ૧૦:૦૦ કલાકે ધ્વજવંદન સમારોહ સંપન્ન થાશે.

- શ્રી જન્માષ્ટમી ઉત્સવ: શુક્રવાર તા.૨૩મી ઓગસ્ટ, સાંજે ૭:૦૦ વાગ્યાથી લઈ મધ્યરાત્રિ સુધી ભજન-કિર્તન સાથે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે.
મુખ્ય યજમાન - શ્રી ભાવેશકુમાર આઈ. પટેલ અને પરિવારજનો (ઓજલ)
- શ્રી ગણેશ મહોત્સવ:
શ્રી ગણેશ સ્થાપન: સોમવાર તા.૨જી સપ્ટેમ્બરના રોજ શ્રી ગણેશચતુર્થીના દિવસે સાંજે ૬:૩૦ કલાકે
વિસર્જન: ગુરુવાર તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ શ્રી અનંત ચતુર્દશીનાં દિવસે સાંજે ૬:૩૦ કલાકે
ઉત્સવ દરમ્યાન ૯ દિવસ સુધી રોજ સાંજે ૬:૩૦ કલાકે શ્રી ગણેશજીનું પૂજન સપન્ન થાશે
મુખ્ય યજમાન: શ્રી ગીજુભાઈ નાનાભાઈ પટેલ અને પરિવારજનો (માંદરીયા)

વાર્ષિક દીપ અંક: દીપ અંકના પ્રકાશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પોતાના મૌલિક લેખો, કાવ્યો કે સંગ્રહો અથવા તો જાહેર ખબર પ્રકાશિત કરવા માટે શ્રી દિનેશ યુ. ૫૧૪-૯૭૯-૩૯૬૪, શ્રી ભાવેશ આઈ. ૫૧૪-૭૭૯-૧૦૩૧ અથવા શ્રી હસુભાઈ સી. ૫૧૪-૯૭૯-૭૧૮૭ નો સંપર્ક સાધવા વિનંતી. આપની કૃતિઓ તથા જાહેર ખબરો પહોંચવાનો છેલ્લો દિવસ રવિવાર, તા. ૧૫મી સપ્ટેમ્બર રહેશે.

વિનમ્ર અપીલ અને સૂચના: આ વર્ષે નવરાત્રિ દરમ્યાન તા.૫મી ઓક્ટોબર અને તા.૧૨મી ઓક્ટોબરનાં ગરબા ટોરન્ટોનાં પ્રોફેશનલ કલાકારોનાં સથવારે સપન્ન થાશે. ગરબા માટે યોગ્ય સ્થળ મેળવવાનાં પ્રયાસો ચાલુ છે અને એ સંદર્ભમાં આપસૌને ટૂંક સમયમાં માહિતગાર કરવામાં આવશે. આ આયોજનોને સફળ બનાવવા માટે આપણાં સમાજના દરેક સંગઠનો, સ્પોર્ટ્સ ક્લબો તેમજ વિવિધ ગ્રૂપોને મદદગાર થવા નમ્ર અપીલ કરીએ છીએ.

આભાર સહિત

લિ. કાર્યવાહક સમિતિ વતી

પ્રમુખ શ્રી

ઈશ્વરલાલ આર, પટેલ



514-389-0181/ ishwar.nila@gmail.com

મંત્રી શ્રી

યોગેશ સી. પટેલ



514-815-9701/ ypatel@skylawn.net